

ત્વરિત જાહેરાત માટે

ઓન યોર માર્ક, ગેટ સેટ ગો! સિટી જાહેર કરે છે પહેલ વહેલી બ્રમ્પટન હાફ મેરેથન

બ્રમ્પટન, ઓન્ટારિયો (26 સપ્ટેમ્બર 2019) – ચાલો તમારા રનિંગ શૂઝની લેસ બાંધવા માંડો અને શરીરને કરસી લો, કારણકે સીટી ઓફ બ્રમ્પટને, લેન્ડમાર્ક સ્પોર્ટ ગ્રૂપ ઇન્ક (Landmark Sport Group Inc) સાથે ભાગીદારીમાં પહેલવહેલી બ્રમ્પટન હાફ મેરેથનની ઘોષણા કરી છે!

જુન 13-14, 2020ના રોજથી શરૂ થતી બ્રમ્પટન હાફ મેરેથન (Brampton Half Marathon) ગમ્મતભર્યા પ્રસંગો અને પ્રવૃત્તિઓથી ભરેલા સપ્તાહના અંતિમ દિવસો હશે જેનો પ્રારંભ જુન 13ના દિને રનર્સ એક્સ્પો (Runners Expo)થી થશે. દોડવીરો પ્રદર્શનમાં ભાગ લેતા લોકોના સ્ટોલની મુલાકાત લઈ શકશે જેમાં પ્રાયોજકો હશે, વિવિધ સામગ્રી, રનિંગ માટેનાં કપડા અને એસેસરિઝ, નુટ્રિશનલ અને ફિટનેસને લગતા ઉત્પાદો હશે, સેપ્લ્સ મળશે અને સાથે બીજું ઘણું બધું હશે.

પ્રતિયોગિતા 14 જૂન 2020ના દિને સવારે 8 વાગ્યે શરૂ થલ્સે અને તેમાં દોડવીરોને હાફ મેરેથન અથવા 10 કિમીની દોડમાં ભાગ લેવાના વિકલ્પો મળશે. માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ સ્ટાર્ટ અને ફિનિશ લાઈન્સ બન્નેનાં યજમાન બન્યા છે જ્યાં દોડવીરો તેમજ પ્રેક્ષકો ઐતિહાસિક કેનેડિયન પેસિફિક રેલવે (Canadian Pacific Railway) સ્ટેશનનો લહાવો લઈ શકશે. એક સિંગલ લૂપ કોર્સ દોડવીરોને શહેરના પશ્ચિમ છેડે લઈ જશે જે હેરિટેજ રોડ (Heritage Road) અને લાયનહેડ ગોલ્ફ ક્લબ (Lionhead Golf Club) પર રહેલ સુંદર વાડીઓમાં થઈને જાય છે.



સહભાગીઓને નીચેની આઠ સ્થાનિક સખાવતી સંસ્થાઓ માટે ભંડોળ ઊભું કરવા અને દાન આપવા આહવાન કરવામાં આવે છે જેઓએ બ્રમ્પટન હાફ મેરથનની ભાગીદારી કરી છે:

- બોયઝ એન્ડ ગર્લ્સ ઓફ પીલ (Boys and Girls Club of Peel), www.bgcpeel.org
- ફ્રી ફોર ઓલ ફાઉન્ડેશન (Free For All Foundation), www.ffaf.ca
- કે બ્લેર હોસ્પિટલ (Kay Blair Hospice)
- નાઈટ્સ ટેબલ (Knights Table), www.knightstable.org
- પીલ ચિલ્ડ્રન્સ એઈડ ફાઉન્ડેશન (Peel Children's Aid Foundation), www.peelcaf.com
- પીલ રિજન ચેપ્ટર ઓફ ઓટિઝમ ઓન્ટારિયો (Peel Region Chapter of Autism Ontario), www.autismontario.com/chapters/peel-region
- સેવા ફુડ બેંક (Seva Food Bank), www.sevafoodbank.com
- યુનાઈટેડ અચીવર્સ ક્લબ ઓફ બ્રમ્પટન (United Achievers' Club of Brampton), www.unitedachieversclub.com

મેરથોન માટે નોંધણી કરવા માંગતા વ્યક્તિઓ, અથવા જે સ્વયંસેવામાં રસ ધરાવતા હોય તેઓ ઓનલાઈન

www.bramptonhalfmarathon.com.ની મુલાકાત લઈને તેમ કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન બુધવારે 10 જૂન 2020ના દિને સાંજે 5 વાગ્યે બંધ થશે. જો પ્રતિયોગિતાની ક્ષમતા પૂરી ભરાઈ નહીં હશે તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓન-સાઈટ કરી શકાશે.

અવતરણો

"બ્રેમ્પટન અને પીલ રિજનની સ્થાનિક સખાવતી સંસ્થાઓને મદદરૂપ થવા લેન્ડમાર્ક સ્પોર્ટ ગ્રૂપ ઈન્ક (Landmark Sport Group Inc) સાથે ભાગીદારીમાં શહેરની પહેલવહેલી હાફ મેરેથન બ્રેમ્પટન ખાતે લાવતા અમને રોમાંચની લાગણી થઈ રહી છે. બ્રેમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે અને અમે બ્રેમ્પટનવાસીઓ તેમજ GTA અને ઓન્ટારિયોમાં રહેતા તમામને જીનમાં જોડાવા આલ્વાન કરી રહ્યા છીએ જે એક ગમ્મત ભર્યો વ્યાયામ અને પ્રવૃત્તિમય વીકેન્ડ પુરવાર થશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"આપના મહાન શહેરમાં એક વિશ્વ સ્તરના લોકસમૂહની સહભાગિતાવાળો રનિંગ/વોકિંગ પ્રસંગ લાવતાં, મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને સીટી ઓફ બ્રેમ્પટન સાથે કાર્ય કરતાં અમને આનંદની લાગણી થાય છે. દોડનો માર્ગ એટલેકે આખો કોર્સ બ્રેમ્પટનની સુંદરતા અને પ્રકૃતિને માત્ર બ્રેમ્પટનવાસીઓ સમક્ષ જ નહીં પરંતુ આખા GTA, ઓન્ટારિયો, કેનેડા તેમજ સમગ્ર વિશ્વના ઉત્સાહી દોડવીરો સામે લાવીને મુક્શે.

- ઈલિયટ કેર (Elliott Kerr), પ્રમુખ, લેન્ડમાર્ક સ્પોર્ટ ગ્રૂપ ઈન્ક (Landmark Sport Group Inc).

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca